

કસ્ટમર ID

ખાતા નં.

પ્રતિ,

મેનેજરશ્રી

ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લી., શાખા

સવિનય, હું/અમો આપની ઉપર દર્શાવેલ શાખામાં બેન્ક એકાઉન્ટ ખોલાવવા માગું/માગીએ છીએ. આ માટે જરૂરી રકમ રૂ.

આ સાથે જમા કરાવું છું / કરાવીએ છીએ.

ખાતાની પસંદગીમાં ટીક કરવું.

☐ સેવિંગ્સ

☐ કરન્ટ

☐ ફીક્સ્ડ ડીપોઝીટ

☐ રીઇન્વેસ્ટમેન્ટ

☐ રીકરીંગ

☐ અન્ય

ખાતેદારનું / ખાતેદારોના નામ (આઈ.ડી. પ્રુફ મુજબ) :

ક્રમ	નામ	પિતા/પતિનું નામ	અટક	કસ્ટમર ID
૧				
૨				
૩				

નોંધ : સગીરના નામે ખાતુ ખોલાવવા માટે પિતા/વાલીનું નામ બીજા ધારક તરીકે, સગીરના નામ પછી દર્શાવવું.

ક્રમ	જન્મ તારીખ	PAN નં.	આધાર કાર્ડ નં.	ફોન / મોબાઇલ
૧				
૨				
૩				

* જો પાન કાર્ડ નંબર ન હોય તો દરેક ખાતેદારના ફોર્મ નં. ૬૦/૬૧ અલગથી જોડવા. • સીનીયર સીટીઝને જન્મ તારીખનો પુરાવો જોડવો.

સરનામું :

કાયમી સરનામું

પત્રવ્યવહારનું સરનામું

મકાન/ફ્લેટનું નામ/નં.		
શેરી/વોર્ડ નંબર		
વિસ્તારનું નામ		
ગામનું નામ	પીન કોડ નં.	પીન કોડ નં.
ઇમેઇલ એડ્રેસ		

ખાતુ ચલાવવા અંગેની સુચના :

નીચે [✓]કરેલ સુચના મુજબ આ ખાતુ ચલાવવા સહિતની તમામ પ્રકારની કાર્યવાહીઓ કરવાના અધિકાર આપીએ છીએ.

☐ પોતાની સહીથી

☐ હયાત પૈકી કોઈપણ એકની સહીથી

☐ વાલીની સહીથી

☐ ખાસ સુચના

પ્ર થ મ	દ્વિ તિ થ	તૃ તિ થ	નમૂનાની સહી
ખા તે દા ર	ખા તે દા ર	ખા તે દા ર	૧ _____ ૨ _____ ૩ _____
પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ	પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ	પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ	

ખાતાનું સ્વરૂપ

☐ જનરલ

☐ સીની. સીટીઝન

☐ કર્મચારી

☐ સભાસદ નં.

ફીક્સડ / રી-ઇન્વેસ્ટમેન્ટ / રીકર્ડીંગ ડીપોઝીટની વિગત

- ૧) ડીપોઝીટનો પ્રકાર
- ☐ ફીક્સડ
- ☐ માસિક વ્યાજ
- ☐ ત્રિમાસિક વ્યાજ
- ☐ રીઇન્વેસ્ટમેન્ટ
- ☐ રીકર્ડીંગ
- ૨) ફીક્સડ/રી ઇન્વેસ્ટમેન્ટ/રીકર્ડીંગ ડીપોઝીટની રકમ રૂ. મુદત વ્યાજનો દર
- ૩) વ્યાજની ચૂકવણી
- ☐ પેઓર્ડરથી
- ☐ NEFT
- ☐ RTGS
- ☐ ખાસ સુચના
- ☐ મારા બેન્ક ખાતા નંબર માં જમા કરવા વિનંતી.
- ૪) થાપણ પાકવા અંગે યાદીપત્ર જોઇએ છીએ
- ☐ હા
- ☐ ના
- ☐ SMS
- ☐ E-mail

અન્ય સવલતો

- ☒ ચેક બુક જોઇએ છે ?
- ☐ હા
- ☐ ના
- ☐ SMS -
- ☐ હા
- ☐ ના
- ☒ ATM કાર્ડ જોઇએ છે ?
- ☐ હા
- ☐ ના
- ☐ Mob
-

Declaration for ATM

I/We hereby declare that information given in this form is correct. I/We hereby agree with the terms & conditions related Debit cum ATM Card & further amendments if any thereto from time to time by the Bank. I/We hereby request the Bank to issue me Debit cum ATM Card & also authorised to the bank to debit my / our above mentioned A/c for all withdrawals made by me / us by using the Debit cum ATM Card & also authorised to recover charges related to Debit cum ATM Card from time to time.

એટીએમ કાર્ડમાં નીચે પ્રમાણેનું નામ પ્રિન્ટ કરવા આથી સૂચના આપીએ છીએ.

----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------	----------------------

ખાતુ સગીરના નામનું હોય તો તેવા કીસ્સામાં

I hereby declare that the date of birth is _____ of the minor applicant _____ who is my _____ and I am his / her natural guardian / lawful guardian appointed by the court order dated _____ (copy encl.). I shall represent the said minor in all future transactions of any description in the above account until the said minor attains majority. I indemnify the bank against the claim of the above minor for any withdrawal / transaction made by me in his / her account.

ગ્રાહકની કબુલાત

- ☒ હું/અમો આથી જાહેર કરું છું/કરીએ છીએ કે, ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્કમાં ખાતુ ખોલાવવા અંગેના હાલમાં અમલમાં છે તે નિયમો મેં/અમોએ વાંચ્યા છે અને તે તથા હવે પછી વખતો વખત બેન્ક દ્વારા તેમાં જે કાંઈપણ ફેરફાર થાય તે મને/અમોને મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે.
- ☒ બેન્કને આ ખાતું સંતોષકારક ચાલતું નથી તેમ જણાશે તો તે ખાતુ બંધ કરવાની કે તે ખાતાની સેવાઓ આગોતરી જાણ કર્યા સિવાય અટકાવવાની/ બંધ કરવાની સંપૂર્ણ સત્તા રહેશે. હું/અમો બેન્ક દ્વારા મારા/અમારા ખાતામાં જુદી-જુદી સેવાઓ અંગે વખતો વખત જે કાંઈપણ ચાર્જિસ ઉધારવામાં આવશે તે અંગે સહમત છું/છીએ.
- ☒ હું/અમો આથી જાહેર કરું છું/કરીએ છીએ કે, હું/અમો ભારતના રહેવાસી છું/છીએ અને ખાતુ ખોલવા અંગે આપેલી વિગતો મારા/અમારા જાણવા મુજબ યોગ્ય અને સાચી છે.
- ☒ હું/અમો આથી સ્વીકારું છું/સ્વીકારીએ છીએ કે, મારા/અમારા ખાતામાં અપૂરતા બેલેન્સને લીધે અવાર-નવાર ચેક રીટર્ન થશે તો બેન્ક મારું/અમારું ખાતું બંધ કરી શકશે.

પ્રથમ ખાતેદાર ની સહી	દ્વિતીય ખાતેદાર ની સહી	તૃતીય ખાતેદાર ની સહી
ઓળખ આપનાર ગ્રાહકનાખાતા નંબર		
ઓળખાણ આપનાર ગ્રાહકનું નામ :		
સરનામું/ફોન નંબર :		
તે હું ઓળખ આપનાર ખાતરી આપું છું કે, હું ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક લી. નો ખાતેદાર છું અને હું અરજદાર(રો) ને સમયથી અંગત રીતે ઓળખું છું અને તેઓએ જણાવેલ ઓળખ, સરનામા, સહિતની માહિતીની પુષ્ટી કરું છું.		

ઓળખ આપનારની સહી

નામાંકન ફોર્મ ડીએ-૧

(૧) ☐ હું/અમો નીચે સહી કરનાર થાપણદાર નીચે જણાવેલ વ્યક્તિને નોમીનેટ કરું છું/કરીએ છીએ કે જે મારા/અમારા/સગીરોના મૃત્યુ થવાના પ્રસંગે, થાપણોની રકમ જેની વિગત નીચે દર્શાવવામાં આવેલ છે, તે ધી વેરાવળ મરફંડાઈલ કો-ઓપ. બેન્ક લી., શાખાએ નીચે જણાવેલ નોમીનીને પરત આપવી.

થાપણ ખાતાનો		નોંધીનીનું નામ અને સરનામું	નોંધીનીનો થાપણદાર સાથેનો સંબંધ	નોંધીનીની ઉંમર/સગીર હોય તો જન્મ તારીખ
પ્રકાર	ખાતા નંબર / રસીદ નંબર			

* (૧.૧) આ તારીખે નોંધની સગીર હોઈ, હું/અમો, શ્રી/શ્રીમતી/કુમારી ને મારા/અમારા/સગીરના, નોંધનીની સગીરાવસ્થા દરમિયાન મૃત્યુ થવાના પ્રસંગે નોંધની વતી થાપણની રકમ મેળવવા માટે નિયુક્તિ કરું છું/કરીએ છીએ.

(૨) ☐ હું/અમો આ ખાતામાં વારસદારની નિમણુંક કરવા ઇચ્છતા નથી.

સ્થળ : ૧. **X**

તારીખ : ૨. X

3. **X**

થાપણદાર (થાપણદારો) ની સહી (સહીઓ)
 અંગુઠાનું નિશાન (નિશાનો)

# સાક્ષીનું નામ	# સાક્ષીનું સરનામું	# સાક્ષી ની સહી
૧.	૧.	૧.
૨.	૨.	૨.

નોંધ :-

- * નોમીની જો સગીર ન હોય તો છેકી નાખો.
- X જ્યાં સગીરના નામે થાપણ મુકવામાં આવેલ હોય, ત્યાં સગીર વતી કાયદેસર રીતે વર્તવા માટે હક્કદાર હોય તે વ્યક્તિએ નોમીનેશન ઉપર સહી કરવી.
- # જો અરજદાર અંગુઠાનું નિશાન કરતા હોય તો તેની ખરાઈ માટે બે સાક્ષીઓની સહીઓ અને તે સિવાય એક સાક્ષીની સહી મેળવવી.

માત્ર બેન્કના ઉપયોગ માટે

ખાતેદાર(રો) ના ફોર્મમાં રજુ થયેલ તમામ વિગત સાથેના ડોક્યુમેન્ટ્સ મુજબ ચકાસતા બરોબર જણાયેલ છે. તેમજ ગ્રાહકોના આર્થિક, સામાજિક, ધંધાકીય વિગત ઉપરથી આ ખાતાને નીચે મુજબની **Risk Category** માં મુકવામાં આવે છે. તેમજ આ ખાતાની ફાઈનાન્સીયલ ટ્રાન્ઝેક્શનની લીમીટ માસિક/વાર્ષિક ધોરણે નીચે મુજબ ફિક્સ કરવામાં આવે છે.

Risk Category : A ☐ Low Risk B ☐ Medium Risk C ☐ High Risk

ફાઇનાન્સીયલ ટ્રાન્ઝેક્શનની લીમીટ : માસિક/વાર્ષિક ધોરણે રૂ.

કમ્પ્યુટરમાં એન્ટ્રી કરનારની સહી

KYC ચકાસણી અધિકારીની સહી

ઓફીસર/બ્રાન્ય મેનેજરની સહી

Emp. Code No. :

Emp. Code No. :

Emp. Code No. :



ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપ. બેન્ક લી.

વહીવટી ઓફીસ : 'સુવાસ', પહેલા માળે, જુનાગઢ રોડ, વેરાવળ - ૩૬૨ ૨૬૬.

KYC ફોર્મ

હું નીચે સહી કરનાર પ્રથમ ખાતેદાર મારી KYC માહિતી રજુ કરું છું.

	નામ	પિતા/પતિનું નામ	અટક
અરજદારનું નામ			
પિતાનું નામ			
માતાનું નામ			

વૈવાહિક સ્થિતિ અભ્યાસ ધર્મ વ્યવસાય પ્રોફેશનલ હોય તો નોકરી હોય તો વેપાર હોય તો કુલ વાર્ષિક આવક ત્રણ વર્ષ દરમિયાન લીધેલ લોનની વિગત રહેઠાણ વાહન જીવન વીમો	☐ પરિણીત	☐ અપરિણીત	☐ જો પરિણીત હોય તો જીવનસાથીનું નામ				
	☐ નોન-ગ્રેજ્યુએટ	☐ ગ્રેજ્યુએટ	☐ પોસ્ટ ગ્રેજ્યુએટ	☐ અન્ય :			
	☐ હિન્દુ	☐ મુસ્લિમ	☐ શીખ	☐ ખ્રીસ્તી	☐ અન્ય જ્ઞાતિ		
	☐ નોકરી	☐ વેપાર	☐ પ્રોફેશનલ	☐ ખેડૂત	☐ સેલ્ફ એમ્પ્લોઇડ		
	☐ ગૃહિણી	☐ નિવૃત્ત/પેન્શનર	☐ વિદ્યાર્થી	☐ અન્ય			
	☐ ડોક્ટર	☐ એન્જીનીયર	☐ સલાહકાર	☐ અન્ય			
	નોકરી દાતાનું નામ :						
	☐ ટ્રેડિંગ	☐ એજન્સી	☐ ઉત્પાદન	☐ અન્ય			
	☐ ૧ લાખ સુધી	☐ ૧ થી ૫ લાખ	☐ ૫ થી ૧૦ લાખ	☐ ૧૦ થી ૨૫ લાખ	☐ ૨૫ લાખ ઉપર		
	☐ પર્સનલ	☐ બીઝનેસ	☐ હાઉસિંગ	☐ કાર			
☐ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશ પ્રવાસની વિગત :							
☐ માલિકી	☐ ભાડે/લીઝ	☐ પારિવારિક	☐ કંપની દ્વારા મળેલ	☐ અન્ય			
☐ નથી	☐ સાઇકલ	☐ ટુ-વ્હીલર	☐ કાર	☐ અન્ય			
☐ નથી	☐ ૧ લાખ સુધી	☐ ૧ થી ૨ લાખ	☐ ૨ થી ૫ લાખ	☐ ૫ લાખ ઉપર			

હું/અમો જાહેર કરું છું/કરીએ છીએ કે હું/અમો આ અથવા અન્ય બેન્કમાં નીચે મુજબની/કોઈપણ પ્રકારની ધીરાણ સવલત/ચાલુ ખાતુ/બેન્ક ખાતુ ધરાવીએ છીએ/ધરાવતા નથી.

અન્ય બેન્કમાં સેવિંગ્સ, કરન્ટ, બાંધી મુદત થાપણ, લોન, ઓવરડ્રાફ્ટ, લોકર ખાતા હોય તો તેની વિગત				
ક્રમ	બેન્ક અને શાખાનું નામ	ખાતા નંબર	ખાતાનો પ્રકાર	કચારથી

આ બેન્કમાં અરજદારના અન્ય ખાતાની વિગત						
ક્રમ	સેવિંગ્સ ખાતા નં.	ચાલુ ખાતા નં.	ફિક્સ ડીપો. ખાતા નં.	સભાસદ નં.	લોન/ઓવરડ્રાફ્ટ ખાતા નં.	લોકર ખાતા નં.

સ્થળ :

તારીખ :

નોંધ : જોઈન્ટ (સંયુક્ત) ખાતુ ખોલવાવા માટે અન્ય અરજદારોએ કે.વાય.સી. માહિતીના ફોર્મ અલગથી ભરવા.

પ્રથમ અરજદારની સહી

ખાતુ ખોલાવવા માટે જોઈતા દસ્તાવેજોની યાદી

ઓળખ અંગેનો પુરાવો (કોઈ એક)	સરનામા અંગેનો પુરાવો (કોઈ એક)	તેમજ વધુમાં નીચેના દસ્તાવેજો જોઈશે
❖ પાસપોર્ટ કોપી ❖ આધાર કાર્ડ ❖ મતદાતાનું ઓળખ કાર્ડ ❖ નોકરી દાતાનું ઓળખ કાર્ડ ❖ ડ્રાઇવિંગ લાયસન્સ ❖ પાન કાર્ડ ❖ ફોટો કેડીટ કાર્ડ	❖ પાસપોર્ટ કોપી ❖ આધાર કાર્ડ ❖ ગેસ જોડાણ કાર્ડ ❖ છેલ્લું ટેલીફોન બીલ ❖ છેલ્લું વિજળી બીલ ❖ અન્ય દસ્તાવેજી પુરાવા	❖ પાનકાર્ડ અથવા ફોર્મ નં. ૬૦/૬૧ ❖ દરેકના તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા વરીષ્ઠ નાગરીક માટે (કોઈ એક) ❖ જન્મનું પ્રમાણપત્ર ❖ સરકારી ઓળખપત્ર ❖ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ❖ ડ્રાઇવિંગ લાયસન્સ ❖ પાસપોર્ટ ❖ પેન્શન કાર્ડ ❖ પાન કાર્ડ